

## વાંચન - Read Carefully

Read 2-3 times. Try to understand the meaning, not just words.

પાણી જીવનનો આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી.  
આપણા શરીરનો ૭૦% ભાગ પાણીનો છે.  
દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.  
પાણીનો ઉપયોગ ખાવા-પીવા, નહાવા, કપડાં ધોવા, રસોઈ બનાવવા થાય છે.  
ખેતી માટે પાણી અતિ આવશ્યક છે. નદી, કૂવા, બોરમાંથી પાણી મળે છે.  
આજે કેટલાક ગામોમાં પાણીની તંગી છે. દુઃખની વાત છે.  
આપણે પાણી બગાડવું ન જોઈએ. નળ ચાલુ ન રાખવો. વરસાદનું પાણી બચાવવું.  
જે પાણી બગાડે, તે જીવન બગાડે છે.

### ■ Instructions - ■■■■■■:

- Page 2: MCQ + Inference questions + True/False
- Page 3: Critical thinking + Application questions + Answer Key

**Section A: બહુ-વિકલ્પ - Multiple Choice**

Choose the correct answer (A, B, C, or D)

1

શરીરમાં પાણીની માત્રા?

- A. ૩૦%  
 C. ૭૦%

- B. ૫૦%  
 D. ૯૦%

2

દરરોજ કેટલા ગ્લાસ પાણી?

- A. ૨-૪  
 C. ૬-૮

- B. ૪-૬  
 D. ૮-૧૦

3

પાણી ક્યાંથી મળે?

- A. નદી  
 C. બોર

- B. કૂવો  
 D. બધાં

**Section B: અનુમાન - Inference**

B1. પાણીની તંગી શા માટે છે?

---

B2. પાણી બગાડવાનું પરિણામ શું?

---

**Section C: સાચું/ખોટું - True/False**

C1. પાણી વગર જીવન શક્ય છે.

 T  F

C2. પાણી ખેતી માટે જરૂરી.

 T  F

C3. આપણે પાણી બગાડવું જોઈએ.

 T  F

## Section D: વિચાર - Critical Thinking

Think deeply. Apply to your own life. No single right answer!

D1

તમે પાણી કેવી રીતે બચાવો છો?

---



---



---

D2

પાણીની તંગીને હલ કરવા શું કરી શકાય?

---



---



---

✓ ANSWER KEY - ■■■■ ■■■■■■■■■■■■:

**Section A (MCQ):**

A1: C A2: D A3: D

**Section B (Inference):**

B1: કારણ કે વરસાદ ઓછો, વેડફાટ વધારે

B2: ભવિષ્યમાં પાણીની તંગી

**Section C (T/F):**

C1: False C2: True C3: False

વધુ Comprehension Practice

[balgujarati.com/std3/comprehension/](http://balgujarati.com/std3/comprehension/)